



PANTH Infinity

INTENDED TO INSPIRE

12th November, 2020

To, The Corporate Relations Department BSE Limited P. J. Towers, Dalal Street, Mumbai-400001, Maharashtra BSE Code: 539143	To, The Listing Department The Calcutta Stock Exchange Limited 7, Lyons Range, Dalhousie, Murgighata, B B D Bagh, Kolkata-700001, West Bengal CSE Code: 30010
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------	-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Sub.: Newspaper publication of Financial Results

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended 30th September, 2020 published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) newspaper dated 12th November, 2020.

Kindly take the same on your record and oblige.

Thanking you.

Yours faithfully,
For **PANTH INFINITY LIMITED**

JINAY KORADIYA
Chairman & Managing Director
DIN: 03362317



Encl.: as above

PANTH INFINITY LIMITED | CIN : L45201GJ1993PLC114416

Registered Office : 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat-395003, Gujarat.



+91-70439 99011



info@panthinfinity.com



www.panthinfinity.com

Chartered Capital And Investment Limited
 Regd Office: 711, Mahakant, Opp. V S Hospital, Ellisbridge, Ahmedabad-380006
 (CIN: L45201GJ1993PLC114416) Phone: +91-79-2657 5337, Fax: +91-79-2657 5731
 Email: info@chartercapital.net, Website: www.chartercapital.net

Extract of Unaudited Financial Results for the Quarter & Half Year Ended September 30, 2020
 (Rs. in Lacs except per share data)

Sr. No.	Particulars	Quarter Ended		
		30 Sept 2020	30 Sept 2019	30 Sept 2018
1	Total Income from operations	34.69	75.04	63.66
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	5.34	14.28	29.69
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	5.34	14.28	29.69
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	11.95	24.54	22.60
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	217.50	1008.95	(111.65)
6	Equity Share Capital	301.16	301.16	301.16
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (Face Value Rs.10/- each)	0.40	0.81	0.75
	- Basic	0.40	0.81	0.75
	- Diluted	0.40	0.81	0.75

The above is an extract of the detailed format of Unaudited Financial Results for quarter/half year ended September 30, 2020 filed with the BSE Limited under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results are available on the Stock Exchange website: www.bseindia.com and also on the company's website: www.chartercapital.net.

Place: Ahmedabad For, Chartered Capital And Investment Limited
 Date: November 11, 2020 Mohib N Khericha, Managing Director

PANTH INFINITY LIMITED
 Reg. Off: 101, Siddh Chambers, Taraya Hanuman Street, Gujar Faliya, Hanpura, Surat-395003, Gujarat
 (CIN: L45201GJ1993PLC114416)
 Tel: 7043990011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com

Extract of Standalone Unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September, 2020
 (Rs. in Lacs)

Sr. No.	Particulars	Quarter ended		
		30.09.2020	30.09.2019	30.09.2018
1	Total Income from operations (net)	472.63	745.35	393.79
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	23.75	44.61	34.16
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	26.66	47.52	34.16
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	19.96	35.53	27.16
5	Total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	11.42	31.82	-160.48
6	Equity Share Capital (face value of Rs. 10/- each)	1232.50	1232.50	1232.50
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	0.00	0.00	0.00
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.16	0.29	0.22
	(a) Basic EPS	0.16	0.29	0.22
	(b) Diluted EPS	0.16	0.29	0.22

Notes:
 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30.09.2020 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Half Yearly Unaudited Financial Results are available on the Stock Exchanges websites: www.bseindia.com and www.cse-india.com and on the Company's Website: www.panthinfinity.com
 2. The above financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 11th November, 2020.
 3. The results have been prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder.

For PANTH INFINITY LIMITED
 Place: Surat, Sd/- Jiny Koradiya
 Date: 11-11-2020 Chairman & Managing Director (DIN: 0392317)

7NR RETAIL LIMITED
 CIN: L52320GJ2012PLC073076 • Ph.:079-48901492
 Regd. Off: B-308, Titanium Heights, Near Vodafone House Corporate Road, Prahaladnagar, Makarba, Ahmedabad, Gujarat-380015 • Web: www.7nrretailid.in • E-mail: info@7nrretailid.in
 Rs. (in Lakhs)

Extract of audited Financial Results for the Quarter & half year Ended on 30th September, 2020

Sr. No.	Particulars	Quarter ended		
		30.09.2020	30.09.2019	30.09.2019
1.	Total Income from Operations (net)	118.59	181.11	425.79
2.	Profit/(Loss) before Exceptional Items and Extraordinary Items and Tax	-12.34	-27.30	57.31
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-12.34	-27.30	57.31
4.	Net Profit / (Loss) for Ordinary Activities after tax	-12.34	-27.30	48.15
5.	Total Comprehensive Income for the period	-12.34	-27.30	48.15
6.	Paid up Equity Share Capital (Rs.10/- Per share)	1047.45	1047.45	1047.45
7.	Earnings per share (a) Basic	-0.12	-0.26	0.46
	(b) Diluted	-0.12	-0.26	0.46

Notes: 1. The above is an extract of the detailed format of Financial Results filed with Stock Exchanges under Regulation 33 of SEBI (LODR) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchanges Website (www.bseindia.com) and on Company's website (www.7nrretailid.in). 2. The said Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in its meeting held on 11.11.2020

For, 7NR Retail Limited
 Sd/-
 MANAGING DIRECTOR
 Date: 11-11-2020

Kotak Mahindra Bank Limited
 Registered Office: 27BKC, C-27, G-Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai-400051
 Branch Office: G1, Twin Tower, Sahara Darwaja, Ring Road Surat 395002.

Whereas, The Undersigned Being The Authorized Officer of Kotak Mahindra Bank Ltd., Under The Securitization And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 (SARFAESI Act) And In Exercise Of Powers Conferred Under Section 13(12) Read With Rule 3 Of The Security Interest (Enforcement) Rules 2002 Issued Demand Notices To The Borrowers/As Detailed Hereunder, Calling Upon The Borrowers To Repay The Amount Mentioned In The Said Notices With All Costs, Charges And Expenses Till Actual Date Of Payment Within 60 Days From The Date Of Receipt Of The Said Notices (Said Borrowers) Having Failed To Repay The Amount, Notice is hereby given to the Borrowers/Co-Borrowers And The Public In General That The Undersigned Has Taken Possession Of The Property Described Hereunder In Exercise Of Powers Conferred On Him Under Section 13(4) Of The Said Act/Rule 8 Of The Said Rules On The Dates Mentioned Along-With. The Borrowers In Particular And Public In General Are hereby cautioned Not To Deal With The Properties And Any Dealings With The Properties Will Be Subject To The Charge Of Kotak Mahindra Bank Ltd., For The Amount Specified Therein With Future Interest, Costs And Charges From The Respective Dates. The Borrowers Attention is Invited To Provisions Of Sub Section (8) Of Section 13 Of The Act, In Respect Of Time Available To Redeem The Secured Assets.

Details Of The Borrowers, Scheduled Property, Outstanding Dues, Demand Notices Sent Under Section 13(2) And Amounts Claimed There Under, Date Of Possession is Given Herein Below:

Sr. No.	Name And Address Of The Borrower, Co-Borrower, Loan Account No., Loan Amount	Details Of The Immovable Property	1. Date Of Possession 2. Demand Notice Date 3. Amount Due In Rs.
01.	Mr. Mehulbhai Pravinbhai Sojitra, Mr. Chirag P. Sojitra & Mr. Arviben M. Sojitra All At: 57, Vrundavan Row House-2, Near Bhajrajram Chowk, Mota Varachha, Surat, Gujarat 394101. Loan Account No.: 4280ZL85038217, 4280ZL8555925, Loan Sanctioned Amount Rs. 49,20,400/- (Rupees Forty Nine Lakhs Twenty Thousand Four Hundred Only).	All that piece and parcel of immovable property bearing Plot No. 57 admeasuring 60.25 sq. mts. in 'Vrundavan Row House - 2' situated at Revenue Survey No. 167/1, Block No. 168 admeasuring Hectar - Acre 1-00-16 Sq. Mts. Of Mouje Village: Motavarachha, City of Surat. The said property is bounded by North-Vado, South-Society Road, East-Plot No. 58, West-Society Plot. Name Of The Mortgagee: Mr. Mehulbhai Pravinbhai Sojitra.	1. 09.11.2020 2. 07.08.2020 3. Rs. 54,26,307.78/- (Rupees Fifty Four Lakh Twenty Six Thousand Three Hundred Seven and Seventy Eight Paise Only) Due And Payable As Of 06.08.2020 With Applicable Interest From 06.08.2020 Until Payment In Full.
02.	Mr. Dineshkumar Behera Mrs. Madhuri Bahera Both At: Flat No. 301 Building D, Sai Raj Residency, Jwa Budia Road, Bhestan, Udhna Surat. Loan Account Number: 428TLH84495345, 428TH184511294 & 428TPY77645058. Total Loan Amount Sanctioned: Rs. 29,11,000/- (Rupees Twenty Nine Lakh Eleven Thousand Only).	All That Piece And Parcel Of Immovable Property Bearing Flat No. D-301 On The 3rd Floor Admeasuring 1172 Sq Ft. I.E. 108.92 Sq Mtrs. Super Built Up Area & 65.35 Sq Mtrs Built Up Area Along With Undivided Share In The Land Of 'Sai Raj Residency, Building No. D' Situate At Revenue Survey No. 166 & Revised Revenue Survey No. 112 Admeasuring 10100 Sq Mtrs. T.P. Scheme No. 48 (Bhestan), Final Plot No. 3, Admeasuring 7070 Sq Mtrs. Of Mouje Bhestan, City Of Surat Name Of The Mortgagee: Mrs. Madhuri Bahera.	1. 09.11.2020 2. 13.07.2020 3. Rs. 33,09,018/- (Rupees Thirty Three Lakh Nine Thousand And Sixteen Only) Due And Payable As Of 13.07.2020 With Applicable Interest From 14.07.2020 Until Payment In Full.
03.	Mr. Ketan Nanavati & Mrs. Purvi Nanavati Both At: B/98, Kawaji Nagar, Nr. Badrinarayan Temple, Adajan, Surat, Gujarat- 395009 Loan Account Number: 428HML67983579 and 428HML679898178. Total Loan Amount Sanctioned: Rs. 21,50,000/- (Rupees Twenty One Lakhs and Fifty Thousand Only).	All That Piece And Parcel Of Immovable Flat No. 505- All That Right, Title And Interest Of Property Bearing Flat No. 505 On The 5th Floor Admeasuring 473 Sq Ft. I.E. 43.94 sq. Mtrs Carpet Area & 780 Sq. Ft. I.E. 72.46 Sq. Mtrs. Super Built Up Area Along With Undivided Share In The Land Of 'Pranjanya Homes Of Building No. B' Situated At Block No. 466, 467, 468 & 471, New Block No. 466 Totally Admeasuring 16087 Sq Mtrs Sub Division No. 1 & 2 Paki Sub Division No. 1 Admeasuring 8602.14 Sq Mtrs, Paki Plot No. A-22 & A-21 Totally Admeasuring 627.10 Sq Mtrs I.E. 750 Sq Yds Of Moje Village Tena, Tal. Odipad, Dist. Surat And Boundaries Of The Property. East-Flat No. 506, West-Flat No. 501, North-Flat No. 508, South-Valkeshwar Resort And Flat No. 506- All That Right, Title And Interest Of Property Bearing Flat No. 506 On The 5th Floor Admeasuring 473 Sq Ft. I.E. 43.94 Sq Mtrs Carpet Area & 780 Sq Ft. I.E. 72.46 Sq Mtrs Super Built Up Area Along With 22.48 Sq Mtrs Undivided Share In The Land Of 'Pranjanya Homes Of Building No. B' Situated At Block No. 466, 467, 468 & 471, New Block No. 466 Totally Admeasuring 16087 Sq Mtrs Sub Division No. 1 & 2 Paki Sub Division No. 1 Admeasuring 8602.14 Sq Mtrs, Paki Plot No. A-22 & A-21 Totally Admeasuring 627.10 Sq Mtrs I.E. 750 Sq Yds Of Moje Village Tena, Tal. Odipad, Dist. Surat And Boundaries Of The Property East-C Tower Land, West-Flat No. 505, North Flat No. 507, South-Valkeshwar Resort. Name Of The Mortgagee: Mr. Ketan Nanavati & Mrs. Purvi Nanavati.	1. 09.11.2020 2. 30.06.2020 3. Rs. 24,72,794/- (Rupees Twenty Four Thousand Seven Hundred and Ninety Four Only) Due And Payable As Of 30.06.2020 With Applicable Interest From 01.07.2020 Until Payment In Full.
04.	Mrs. Kavita Hiteshbhai Maniya, Mr. Hiteshbhai Jivrajbhai Maniya & M/S. Shree Sai Fashion Through its Authorized Signatory/ Proprietor Mr. Hiteshbhai Jivrajbhai Maniya All At: A2-302, Subham Apartment, Yogi Chowk, Choksi/Bombay Market Gujarat 395010. Loan Account Number: 428HML51168513 & 428TH157676405 Total Loan Amount Sanctioned: Rs. 21,36,000/- (Rupees Twenty One Lakh Thirty Six Thousand Only).	All that piece and parcel of the property bearing plot No. 25 Admeasuring 68.52 Sq Mtrs I.E. 76 Yds long and 40.35 Sq Mtrs Undivided Share In The Land Of 'Pranjanya Homes Residency' Situated At Block No. 216 Admeasuring 8086 Sq Mtrs Of Moje Village Velanja Tah-Kamej And Det. Surat, Gujarat 394180 Bounded By North: Plot No. 26; South: Plot No. 24; East: Plot No. 10; West: Society Road. Name Of The Mortgagee: Mrs. Kavita Hiteshbhai Maniya And Mr. Hiteshbhai Jivrajbhai Maniya.	1. 09.11.2020 2. 30.06.2020 3. Rs. 24,72,794/- (Rupees Twenty Four Thousand Seven Hundred and Ninety Four Only) Due And Payable As Of 30.06.2020 With Applicable Interest From 01.07.2020 Until Payment In Full.
05.	Mr. Hanrikshnabhai Brambhatt & Mrs. Hansaben Brambhatt Both At: A/34 Pansarhwar Bunglow, Near Anupura Restaurant, Jasadnagar, Ahmedabad, Gujarat- 380001. Both Also At: Unit No C-1/7 ILA Society, B/H Sars India, Opp Matushkhi Society, India Colony, Thakarbanagar, Ahmedabad 382350. Loan Account Number: 418HML51605168 Total Loan Amount Sanctioned: Rs. 48,00,000/- (Rupees Forty Eight Lakhs Only).	All that right, title and interest of property bearing Tenament No. C/17 admeasuring 109 sq. mts. And construction thereon measuring 59.89 sq. mts. As a member of ILA Co-operative Housing Society Limited situated at land bearing Survey No. 277, 278 & 280 Paki Sub Plot No. 540 to 562, 599-620, 622 to 636, 658 to 661, 667 to 671, 673 to 676, 637 to 657 Paki of Moje Salpur Bogha, Taluka Asawa in the District of Ahmedabad and Registration Sub District of Ahmedabad - 6 (Naroda) The said property bounded as: East: House No. C/18, West: Society road, North: Society Road, South: House No. C/16. Name Of The Mortgagee: Mr. Hanrikshnabhai Brambhatt and Mrs. Hansaben Brambhatt.	1. 11.11.2020 2. 05.08.2020 3. Rs. 48,67,751.98/- (Rupees Forty Nine Lakh Sixty Seven Thousand Seven Hundred and Fifty One and Ninety Eight Paise Only) Due And Payable As Of 05.08.2020 With Applicable Interest From 06.08.2020 Until Payment In Full.

PLACE: Surat & Ahmedabad For Kotak Mahindra Bank Limited
 DATE: 12.11.2020 Authorized Officer
 For any query please Contact Mr. Ravinder Godara (Mobile No. +91 9983999074) and Mr. Brijesh Parmar (Mobile No. +91 972739158)

NHC FOODS LIMITED
 Reg. off: Survey No. 777, Umarsadi Desawad Road, at Village Umarsadi, Taluka Pardi, Killa Pardi, Gujarat- 396175. Website: www.nhgroup.com, Contact No. 022-48615100, Fax: 022-48615101
 Email id: grievances@nhgroup.com, CIN: L15122GJ1992PLC076277

Extract of Unaudited Financial Results for the Second Quarter and Half Year Ended 30th September, 2020.
 (Rs. in Lakhs)

PARTICULARS	Quarter ended		Half Year ended		Year ended 31.03.2020 Audited
	30.09.2020 Unaudited	30.06.2020 Unaudited	30.09.2019 Unaudited	30.09.2019 Unaudited	
1. Total Income from Operations	4419.91	3265.96	3185.10	7705.87	5959.76
2. Net Profit for the period (Before tax, Exceptional and/or Extraordinary items)	55.04	40.37	31.72	95.41	154.86
3. Net Profit for the period before tax (after exceptional and/or extraordinary items)	55.04	40.37	31.72	95.41	154.86
4. Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	28.87	39.71	25.57	68.58	68.17
5. Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) and other Comprehensive income (after tax))	(0.50)	(0.50)	(0.50)	(1.00)	(1.00)
6. Equity Share Capital	1185.50	1185.50	1185.50	1185.50	1185.50
7. Reserves (excluding revaluation reserve as shown in the Balance Sheet of previous Financial Year)	-	-	-	-	-
8. Earnings per share (of 10/- each) (For continuing and discontinued operations)	0.24	0.33	0.21	0.58	0.57
(a) Basic	0.24	0.33	0.21	0.58	0.57
(b) Diluted	0.24	0.33	0.21	0.58	0.57

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results is available on the website of the Company i.e. www.nhgroup.com as well as on the website of the Stock Exchange viz. www.bseindia.com
 2. The above result have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on 11th November, 2020. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the Results.

For NHC FOODS LIMITED
 Sd/-
 Apoorva Shah
 Managing Director
 DIN: 00573184
 Date: 11.11.2020

UCO BANK
 (A Govt. of India Undertaking)
 HONOURS YOUR TRUST

SALE NOTICE E - AUCTION

UCO Bank, Ambika Complex, Paldi Cross Road, Ahmedabad-380007, E-mail: pdali@ucobank.co.in, Phone No. 079 - 26586187.

Whereas under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, the Authorized Officer has issued demand notice dated 20.11.2019 for the recovery of sum of Rs. 54,43,449.98 (Rupees Fifty Four Lakh Forty Three Thousand Four Hundred Forty Nine and Paise Ninety Eight Only) on 31.10.2019 (Inclusive of interest charged up to 31.07.2019) from the Borrowers / Guarantors / Mortgagees (herein referred to as borrowers). Further, in exercise of powers contained in the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, the Authorized Officer has taken the Physical Possession of the under mentioned secured assets on 07.02.2020 which are held as securities in respect of Loan/Credit facilities granted to M/s. Madhuvan Ferroalloys Pvt. Ltd. Whereas sale of the secured asset/s is to be made through Public E-Auction for recovery of the secured debt to UCO Bank amounting to Rs. 54,43,449.98 as on 31.10.2019 plus interest and expenses incurred by the bank thereon. The General Public is invited to bid either personally or by duly authorized agent.

SCHEDULE OF THE SECURED ASSETS

Name of Borrower & Guarantors	Description of the Properties	Reserve Price & EMD
M/s. Madhuvan Ferroalloys Pvt. Ltd. (Borrower / Mortgagee)	Property No. 1:- All part and parcel of property being Flat No. 504 of Block No. 9M, 5th Floor, Admeasuring 108 Sq. Yards i.e. 90.30 Sq. Mt. constructed on land bearing Survey No. 1017/B of Moje - Sachana, Taluka - Viramgam and Dist. Ahmedabad in the project known as "Aagam 99 Residency" Phase - II together with undivided proportionate share admeasuring 52 Sq. Yrds i.e. 43.55 Sq. Mtrs. being Revenue Survey No. 1017/A, Adm. 6880 Sq. Mtrs and Survey No. 1017/B, Admeasuring 10624 Sq. Mtrs. and Survey No. 1017/C, Admeasuring 10521 Sq. Mtrs. lying and being at Moje - Sachana, Taluka - Viramgam in the Registration Sub District - Viramgam and Dist. Ahmedabad.	Rs. 11,54,000/-
	Property No. 2:- All part and parcel of property being Flat No. 302 of Block No. 18H, 3rd Floor, Admeasuring 108 Sq. Yards i.e. 90.30 Sq. Mt. constructed on land bearing Survey No. 1017/B of Moje - Sachana, Taluka - Viramgam and Dist. Ahmedabad in the project known as "Aagam 99 Residency" Phase - II together with undivided proportionate share Adm. 52 Sq. Yrds i.e. 43.55 Sq. Mtrs. being Revenue Survey No. 1017/A, Admeasuring 6880 Sq. Mtrs. and Survey No. 1017/B, Admeasuring 10624 Sq. Mtrs. and Survey No. 1017/C, Admeasuring 10521 Sq. Mtrs. lying and being at Moje - Sachana, Taluka - Viramgam in the Registration Sub District - Viramgam and Dist. Ahmedabad. Above Properties are belongs to Mr. Nareshkumar J. Vaishnav.	Rs. 1,15,400/-
Guarantors : (1) Mr. Nareshkumar J. Vaishnav (2) Mr. Jankilal H. Vaishnav Director : M/s Madhuvan Ferroalloys Pvt. Ltd. B/87, Vijaydhami Society, Nr. Rajdeep Park, Odhav, Ahmedabad.		Rs. 11,54,000/- Rs. 1,15,400/-

Outstanding Amount as on Date 31.10.2019 : Rs. 54,43,449.98 as on 31.10.2019 plus interest and expenses.
 Date & Time of E-Auction : 22.12.2020, Time : 11:00 AM to 1:00 PM
 Last Date of Deposit of EMD : 19.12.2020 Up to 4:00 PM
 Date & Time of Inspection : 15.12.2020, Time : 11:00 AM to 4:00 PM

The sale shall be subject to the Terms & Conditions prescribed in the Security Interest (Enforcement) Rules 2002 and to the following further conditions:
 (1). The properties are being sold on "As is where is", "As is what is", and "Whatever there is".
 (2). The particulars of Secured Assets specified in the Schedule herein above have been stated to the best of the information of the Authorized Officer, but the Authorized Officer shall not be answerable for any error, misstatement or omission in this proclamation.
 (3). The secured asset will not be sold below the reserve price.
 (4). The auction sale will be "online through e-auction portal www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp
 (5). The bidders are also advised to go through the portal https://ibapi.in or www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp
 (6). For more details if any prospective bidders may contact Mr. Ravi Kumar Kachhava, Authorized Officer (M): 7567182246.

Date: 10.11.2020 Sd/-
 Place: Ahmedabad Authorized Officer, UCO Bank

NOTICE FOR HEARING OF PETITION
 (Pursuant to Section 230-232 of the Companies Act, 2013 read with Rule 16(1) of the Companies (Compromise, Arrangements and Amalgamations) Rules, 2016)
BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL, AHMEDABAD BENCH
 CP (CAA) No. 55/NCLT/AHM/2020
 CA (CAA) No.58/NCLT/AHM/2020

In the matter of Composite Scheme of Arrangement between Aprica Healthcare Limited (AHL or 'Transferor Company 1') and Eris Therapeutics Private Limited ('ETPL' or 'Transferor Company 2') and UTH Healthcare Limited (UTH or 'Transferee Company/Resulting Company') and Kinedex Healthcare Private Limited ('KHPL' or 'Demerged Company') and their respective shareholders and creditors.

Aprica Healthcare Limited
 (CIN: U24290GJ2016PLC092903) (Petitioner/Transferor Company 1)

Eris Therapeutics Private Limited
 (CIN: U24230GJ2009PTC057670) (Petitioner/Transferor Company 2)

UTH Healthcare Limited
 (CIN: U24232GJ2011PLC112374) (Petitioner/Transferee/Resulting Company)

Kinedex Healthcare Private Limited
 (CIN: U51397GJ2002PTC112851) (Petitioner/Demerged Company)

NOTICE OF HEARING OF THE PETITION
 A petition under Section 230 to 232 of the Companies Act, 2013, for sanctioning the Composite Scheme of Arrangement among Aprica Healthcare Limited (AHL or 'Transferor Company 1') and Eris Therapeutics Private Limited ('ETPL' or 'Transferor Company 2') and UTH Healthcare Limited (UTH or 'Transferee Company/Resulting Company') and Kinedex Healthcare Private Limited ('KHPL' or 'Demerged Company') and their respective shareholders and creditors, was presented by the Petitioner Companies on the 13th October, 2020 and was admitted by the Hon'ble National Company Law Tribunal Bench, at Ahmedabad ('Hon'ble NCLT') on the 03rd November, 2020. The said petition is now fixed for final hearing on Wednesday, the 09th Day of December, 2020 before the Hon'ble NCLT, Ahmedabad Bench at Corporate Bhawan, 1st & 2nd Floor, Opp. Zyodus Hospital, Sarkhej - Gandhinagar Highway, Ahmedabad-380054.

Any person desirous of supporting or opposing the said petition should send notice of his intention, signed by him or his advocate, with his name and address to the petitioner Company's representative Mr. Ravi Kapoor, Practicing Company Secretary at 402, Shaivaly Plaza, Near Gujarat College, Ellisbridge, Ahmedabad-380 006 and same would reach the petitioner Company's representative not later than two (2) days before the date fixed for hearing of the Petition. Where such person seeks to oppose the petition, the grounds of opposition or a copy of his affidavit intended to be used in opposition to the petition should be filed with Hon'ble NCLT, Ahmedabad Bench at address mentioned herein above and copy thereof served to the Petitioner Company's representative not later than two (2) days before the date fixed for hearing.

A copy of the petition will be furnished by the Petitioner Company's representative to any person requiring the same on the payment of the prescribed charges for the same.

For UTH Healthcare Limited
 Sd/-
 (Milind Talegaonkar)
 Authorized Signatory
 Date: 10-11-2020
 Place: Ahmedabad

OCEANIC FOODS LIMITED
 (CIN L15495GJ1993PLC019383)

Registered Office: Opp. Brooke Bond Factory, P.N. Marg, Jammagar-360 002, Gujarat, India. Tel. +91 0288-2757355-66-77 Fax: +91-0288-2757333
 Website: www.oceanicfoods.com E-mail: cs@oceanicfoods.com

NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING Remote E-voting Information and Book Closure

Notice is hereby given that the 27th Annual General Meeting (AGM) of the members of the OceanicFoods Limited will be held on Monday, 30th November 2020 at 03.00 P.M. at the Registered Office of the Company situated at Opp. Brooke Bond Factory, P. N. Marg, Jammagar - 361 002, Gujarat to transact the business as set out in the Notice convening the Annual General Meeting (AGM).

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 read with Amendment Rules, 2015 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide e-voting facility for transacting all the items of business through NSDL's Platform to its Members to exercise their right to vote on all the Resolutions set forth in the Notice convening the 27th Annual General Meeting scheduled to be held on Monday, 30th November 2020 at 03.00 P.M.

The Company has engaged the services of National Securities Depository Limited ("NSDL") for providing e-voting facilities to the Shareholders.

1. The Ordinary and Special business set out in the Notice of 27th AGM may be transacted through voting by electronic means;
 2. The cut-off date for the purpose of determining the eligibility to vote by electronic means or at AGMs Monday, 23rd November 2020. A person, whose name appears in the Register of Members/Beneficial Owners as at the close of the business hours on the cut-off date i.e. 23rd November 2020 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the Annual General Meeting.
 3. Date of commencement of e-voting: Friday, 27th November 2020 from 09.00 A.M.
 4. Date of end of e-voting: Sunday, 29th November 2020 upto 05.00 P.M. (E-voting through electronic mode shall not be allowed beyond 05.00 PM)
 5. Member may participate in the General Meeting even after exercising his right to vote through remote e-voting shall not be allowed to vote again in the meeting
 6. Notice of Annual General Meeting is available on the Company's Website www.oceanicfoods.com.
 7. Any person, who acquires shares of the company and becomes member of the Company after dispatch of the notice of the 27th AGM and holding shares as of the cut-off date i.e. Monday, 23rd November 2020, may obtain the login ID and password by sending request atoting@nsdl.co.in or cs@oceanicfoods.com however if a person is already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote.
 8. Members may be note that: a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility for voting through ballot papers shall be made available at the AGM; and c) a person whose name is recorded in the Register of Members and list of Beneficial Owners as on the cut off date i.e. Monday, 23rd November 2020 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM through ballot paper; Pursuant to the provision of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules 2014 read with Amendment Rules, 2015 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share transfer books shall remain closed from Tuesday, 24th November 2

